

Date: 14th February, 2025

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street,
Mumbai – 400 001

Dear Sir / Ma'am,

**Subject: Newspaper Advertisement of extract of Unaudited Financial Results
for the Quarter and Nine Month ended on 31st December, 2024**

Ref: Security Id: MUNCAPM/ Code: 511200

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement on 14th February, 2025 of Unaudited Financial Result for the Quarter and Nine Month ended on 31st December, 2024 in:

1. English Newspaper – Financial Express Newspaper and
2. Regional Language Newspaper (Gujarati) – Financial Express Newspaper

Kindly take the same on your record and oblige us.

Thanking You.

For, Munoth Capital Market Limited

Siddharth Jain
Managing Director
DIN: 00370650

Gujarat Winding Systems Limited

CIN: L22122GJ1988PLC010503
Regd. Office: 08, Gokul Complex, Opp. Nagri Hospital, Gujarat College Road, Ellisbridge, Ahmedabad - 380006 | **Mob:** 7043658404
E-mail: hitchwindinssystemslimited@gmail.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31/12/2024

Sl No.	Particulars	₹ (in Lakhs except EPS)		
		Quarter Ending on 31.12.2024	Year to Date 31.12.2024	Corresponding Three Months Ended in the Previous Year 31.12.2023
1	Total income	15.13	23.27	0.48
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	6.27	9.99	0.26
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	6.27	9.99	0.26
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	4.70	8.38	0.26
5	Total Comprehensive Income for the period (after tax)	4.70	8.38	0.26
6	Equity Share Capital	485.790	485.790	485.790
7	Face Value of Equity Share Capital	10	10	10
8	Earnings Per Share (Basic / Diluted)	0.10	0.17	0.01

Note: The above is an extract of the detailed format of Quarterly and Nine Months Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly and Nine Months Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com.

For Gujarat Winding Systems Limited (Formerly known as Hi-Tech Winding Systems Limited)
Sd/-
CHANDUBHAI VAGHELA
 DIRECTOR
 Date: 12.02.2025
 Place: Ahmedabad
 DIN: 05197958

MUNOTH CAPITAL MARKET LIMITED

CIN: L99999GJ1986PLC083614
Address: Shanti Nivas, Opp. Shapath - V. Nr. Karnavati Club, S.G. Road, Ahmedabad, Ahmedabad - Gujarat - 380058

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED 31/12/2024

Sl No.	Particulars	₹ (in Lakhs except EPS)		
		Quarter Ending on 31.12.2024	Year to Date 31.12.2024	Corresponding Three Months Ended in the Previous Year 31.12.2023
1	Total income	9.31	33.73	9.69
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4.06	11.03	-15.31
3	Net Profit / (Loss) for the period before Tax, (after Exceptional &/or Extraordinary items)	4.06	11.03	-15.31
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional &/or Extraordinary items)	3.43	9.31	-15.31
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	3.43	9.31	-15.29
6	Equity Share Capital	458.30	458.30	449.55
7	Face Value of Equity Share Capital	5	5	5
8	Earnings Per Share (Basic / Diluted)	0.04	0.10	-0.17

Note: The above is an extract of the detailed format of Quarterly and Nine month Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly and Nine month Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and Company website i.e. www.munoth.com.

For, Munoth Capital Market Limited
Sd/-
Siddharth S Jain
 Managing Director
 Date: 12.02.2025
 Place: Ahmedabad
 DIN: 00370650

TATA CAPITAL LIMITED

Registered Office: Tower A, 11th Floor, Peninsula Business Park, Ganpatrao Kadam Marg, Lower Panel, Mumbai 400013.
 Branch Address: Office No. 501-502-503-504, 5th Floor, Regus Business Center, New City Light Road, Surat 395007

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY (Under Rule 8(6) R/W Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002)

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision of Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

LOAN ACCOUNT NOS: TCFLA021600011058845 And TCFLA021600011058836 And TCFLA021600011058839 And TCFLA021600011089185; M/S. KRISHNA CREATIONS

This is to inform that Tata Capital Ltd. (TCL) is a non-banking financial company and incorporated under the provisions of the Companies Act, 1956 and having its registered office at Peninsula Business Park, Tower A, 11th Floor, Ganpatrao Kadam Marg, Lower Panel, Mumbai - 400013 and a branch office amongst other places at Ahmedabad ("Branch"). That vide Order dated 24.11.2023, the National Company Law Tribunal (NCLT) Mumbai has validly sanctioned the Scheme of Arrangement between Tata Capital Financial Services Limited ("TCFSL") and Tata Cleantech Capital Limited ("TCL") as transferees and Tata Capital Limited ("TCL") as transferor under the provisions of Sections 230 to 232 read with Section 66 and other applicable provisions of the Companies Act, 2013 ("said Scheme"). In terms thereof, TCFSL and TCL, (Transferor Companies) along with its undertaking having merged with TCL, as a going concern, together with all the properties, assets, rights, benefits, interest, duties, obligations, liabilities, contracts, agreements, securities etc. w.e.f. 01.01.2024. In pursuance of the said Order and the Scheme, all the facility documents executed by TCFSL and all outstanding in respect thereof stood transferred to Applicant Company and thus the TCL is entitled to claim the same from the [Borrowers/Co-Borrowers] in terms thereof.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/Co-Borrower that the below described immovable property mortgaged to Tata Capital Limited (Secured Creditor/TCL), the Possession of which has been taken by the Authorised Officer of Tata Capital Limited (Secured Creditor/TCL), will be sold on 12th Day of March, 2025 "As is where is basis" & "As is what is and whatever there is & without recourse basis".

Whereas the sale of secured asset is to be made to recover the secured debt and whereas there was a due of sum Rs. 2,63,83,314/- (Rupees Two Crore Sixty Three Lakhs) Eighty Three Thousand Three Hundred Fourteen Only vide Loan Account bearing No. TCFLA021600011058843 & TCFLA021600011058836, the said secured asset is being offered for sale by the Authorised Officer of Tata Capital Limited (Secured Creditor/TCL), will be sold on 12th Day of March, 2025 "As is where is basis" & "As is what is and whatever there is & without recourse basis".

Whereas the sale of secured asset is to be made to recover the secured debt and whereas there was a due of sum Rs. 2,63,83,314/- (Rupees Two Crore Sixty Three Lakhs) Eighty Three Thousand Three Hundred Fourteen Only vide Loan Account bearing No. TCFLA021600011058843 & TCFLA021600011058836, the said secured asset is being offered for sale by the Authorised Officer of Tata Capital Limited (Secured Creditor/TCL), will be sold on 12th Day of March, 2025 "As is where is basis" & "As is what is and whatever there is & without recourse basis".

The sealed E-Auction for the purchase of the property along with EMD Demand Draft shall be received by the Authorized Officer of the TATA CAPITAL LIMITED on 11th Day of March, 2025.

Description of Secured Asset	Type of Possession	Reserve Price (Rs.)	Earned Money EMD (Rs.)
Property No.1: All rights, Title and Interest in Non-Agriculture Property Bearing Revenue Survey No. 159/2, T.P. Scheme No. 4 (Umara South), F.P. No.135, paiki Constructed Building Name- "Swastik Heights" Paiki Second Floor Flat No. 202 admeasuring 167.77 Sq. Mtr. and Undivided Share in Land admeasuring 61.30 Sq. Mtrs of Umra Taluka Surat City and District Surat. Which is bounded as under: On or Towards East:- Adjoining F.P. No. 134 Paiki Land; On or Towards West:- Adjoining F.P. No. 135 Paiki Land; On or Towards North:- Adjoining F.P. No. 135 Paiki Land and On Towards South:- Adjoining Public Road.	Physical	Rs. 91,91,880/- (Rupees Ninety One Lakhs) Ninety One Thousand Eight Hundred Eighty Only)	Rs. 9,19,188/- (Rupees Nine Lakhs) Nineteen Thousand One Hundred Eighty Eight Only)
Property No.2: All rights, title and interest in Non-Agriculture Property Bearing Revenue Survey No. 118, Block No. 190/Paiki 2, T.P. Scheme No. 69 (Godadara Dindoli) F.P.No. 161, admeasuring 13951 Sq. Mtrs Paiki project Name- "Rajmahal Mall" paiki Third Floor, Shop No. F/C-26, Having Carpet Area admeasuring 58.10 Sq Mtrs of Dindoli Taluka & Dist. Surat.	Physical	Rs. 10,87,000/- (Rupees Ten Lakhs) Eighty Seven Thousand Only)	Rs. 1,08,700/- (Rupees One Lakhs) Eighty Seven Thousand Only)
Property No.3: All rights, Title and Interest in Non-Agriculture Property Bearing Revenue Survey No. 13, Block No. 37, T.P. Scheme No. 8 (Palanpore), F.P. No. 25, admeasuring 6104 Sq. Mtrs Paiki Constructed Building Name- "Trinity Business Hub" Paiki Second Floor, Shop No. 204, Having Built up area admeasuring 21.83 Sq.Mtr. of Palanpore Taluka Adajan and District Surat.	Physical	Rs. 80,100/- (Rupees Eighty Thousand Only)	Rs. 80,100/- (Rupees Eighty Thousand Only)

The description of the property that will be put up for sale is in the Schedule. Movable articles/House hold inventory if any lying inside and with secured asset as described above shall not be available for sale along with secured asset until and unless specifically described in auction sale notice. The sale will also be stopped if, amount due as aforesaid, interest and costs (including the cost of the sale) are tendered to the Authorized Officer or proof is given to his satisfaction that the amount of such secured debt, interest and costs has been paid. At the sale, the public generally is invited to submit their tender personally. No offer or other person, having any right to participate in connection with this sale shall, however, directly or indirectly bid for, acquire or attempt to acquire any interest in the property sold. The sale shall be subject to the terms/conditions prescribed under the SARFAESI Act, 2002. The E-auction will take place through portal <https://bid.eauction.com> on 12th Day of March, 2025 between 2.00 PM to 3.00 PM with unlimited extension of 10 minutes. All the Bids submitted for the purchase of the property shall be accompanied by Earnest Money as mentioned above by way of a Demand Draft favoring the "TATA CAPITAL LIMITED" payable at Surat. Inspection of the property may be done on 04th Day of March, 2025 between 11.00 AM to 5.00 PM.

Note: The intending bidders may contact Tata Capital Limited at Mobile No. +91-8691005238 & Authorized Officer Mr. Harangad Bhoqai; Email ID: harangad.bhoqai@tatacapital.com and Mobile No. +91 8657563008.

For detailed terms and conditions of the Sale, please refer to the link provided in secured creditor's website. i.e. <http://www.tatacapital.com/content/dam/tata-capital/pdf/e-auction/tcfsla06th-E-Auction-News-Publication-Krishna-Creation.pdf>

Sd/-
Authorized Officer
Tata Capital Limited
 Date: 14-02-2025

Home First Finance Company India Limited

CIN: L65990MH2010PLC240703
Website: homefirstindia.com
Phone No.: 180030008425 **Email ID:** loanfirst@homefirstindia.com

POSSESSION NOTICE

REF: POSSESSION NOTICE UNDER SUB-RULE (1) OF RULE 8 OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002

WHEREAS the undersigned being the Authorized Officer of HOME FIRST FINANCE COMPANY INDIA LIMITED, pursuant to demand notice issued on its respective dates as given below, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under section 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 calling upon you/Borrowers, the under named to pay outstanding dues as within 60 days from the date of receipt of respective notices. You/Borrowers all, however, failed to pay the said outstanding dues within stipulated time, hence HOME FIRST FINANCE COMPANY INDIA LIMITED are in exercise and having right as conferred under the provision of sub section (4) of section 13 of SARFAESI ACT, 2002 read with rules thereunder, taken POSSESSION of the secured assets as mentioned herein below:

Sr. No.	Name of Borrowers/ Co-Borrowers/ Guarantors	Description of Mortgaged Property	Date of Demand Notice	Total O/s as on date of Demand Notice (in INR)	Date of possession
1.	Sunilbhai Surela, Tejalben Sunilbhai Surela	House - part no. 1, plot no. 22, Harisidhi Park (Plot No. 22), part no. 1 to 2 P part 1, Plot No. 22, Harisidhi Park, Nr Ribda Railway Station, Off Ribda - Naranaka Road, Vill : Gundasara, Sub Dist : Gondal, Dist : Rajkot 360311, Rajkot, Gujarat-360311. Bounded By: North by - Common Road, South by - Road, East by - House (part-2), West by - Plot No. 21.	03-11-2024	15,61,433	10-02-2025
2.	Binduben Tiwari, Jaychandra Tiwari, Ravishankar Tiwari	Plot-47, Divine Villa, Phase-NA, Block No - 743/1, Moje - Hathuran, Tal - Mangrol - Tarsadi, Surat, 394125. Bounded by - East by : Plot No. 51, West by : Society Road, North by : Plot No. 48, South by : Plot No. 46.	04-07-2024	6,99,846	12-02-2025

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower / Guarantor and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said rule on the date mentioned above.

The BORROWERS/ GUARANTORS and the PUBLIC IN GENERAL are hereby cautioned not to deal with the above referred Properties/Secured Assets or any part thereof and any dealing with the said Properties/Secured Assets shall be subject to charge of HOME FIRST FINANCE COMPANY INDIA LIMITED for the amount mentioned hereinabove against Properties/Secured Assets which is payable with the further interest thereon until payment in full.

The borrower's attention is invited to the provisions of subsection (8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured asset.

Place: Gujarat
 Date: 14-02-2025

Authorized Officer,
 Home First Finance Company India Limited

Bank of Baroda

Odhav Branch: Create Ice-Cream Building, Plot No. 296, Soni ki Chaw GIDC, Odhav, Ahmedabad-382415, Ph.079-22892353
 E-mail: odhav@bankofbaroda.co.in, Web: www.bankofbaroda.in

SALE NOTICE (15 DAYS) FOR SALE OF IMMOVABLE PROPERTIES APPENDIX-IV-A [See proviso to Rule 6(2) & 8 (6)]

Notice is hereby given to the public in general and in particular to the Borrower/Mortgagor/Guarantor that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, Physical possession of which has been taken by the Authorized Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" without recourse basis on or recovery of below mentioned accounts. The details of Borrower/Mortgagor/Guarantor's Secured Assets/Dues/Reserve Price-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below.

Branch Name & Address of Borrower/ Guarantor/ Mortgagors	Give short description of the immovable property with known encumbrances, if any	Total Dues (As per Demand notice)	Reserve Price EMD & Bid Increase Amount
Branch - Odhav 1. M/s Yamraj Education System Pvt Ltd (Borrower), Address: Shed no. 4513, Phase 4, GIDC Vava, Ahmedabad-382445. 2. Mr. Anandkumar Jyantil Panchal (Director & Guarantor) Address - C- 782, Amrah Society Vibhag 2, Abudnagar Opp: Bus stand, Behind Rabari Colony, Odhav, Ahmedabad-382415. 3. Mrs. Parulben Jagdishchandra Panchal (Director & Guarantor) Address - C- 782, Amrah Society Vibhag 2, Abudnagar Opp: Bus stand, Behind Rabari Colony, Odhav, Ahmedabad-382415	All that piece and parcel of immovable Residential property bearing Tenament no. C/782, consisting of plot admn. 128 sq. mtrs. along with construction admn. 89 sq. mtrs. thereon along with undivided share of land in the society known as "Amrah Society" situated lying and being at revenue survey no 4421/ paiki 4422, 445-446/1 vide final Plot no 25.35 of TP scheme no 2 of Moje Odhav, Taluka Vava in the registration district sub district Ahmedabad belonging to Mr. Anandkumar J Panchal s/o Jayantil Nalvarlal Panchal, bounded as under: East: Tenament no. C/783, West: Public Road, North: Tenament no C/791, South: Tenament no C/789.	Rs. 69,36,537.06/- (Rupees Sixty Nine Lakh Thirty Six Thousand Five Hundred Thirty Seven and Six Paise Only) as on 31.07.2024. (With reference to Demand Notice u/s 13(2) Dated: 22.05.2024) (Pending Litigation: NIL)	Reserve Price: Rs. 45,35,000/- EMD: Rs. 4,53,500/- Increase amount for all Properties upto Rs. 100.00 lakhs is Rs. 25000/- & above Rs. 100.00 lakhs is Rs. 50000/-

E-Auction Date : 03.03.2025 and E-Auction Time: 02:00 PM to 06:00 PM (unlimited extension of 10 minutes)
Inspection Date & Time: 01/03/2025 from 11:00 AM to 02:00 PM (BY TAKING PRIOR APPOINTMENT)

For detailed terms and conditions of sale, please refer to the link provided in <https://www.bankofbaroda.in/e-auction.htm> and [### RATNAMANI METALS & TUBES LTD.

Regd. Office: 17, Rajmugat Society, Naranpura Char Rasta, Ankur Road, Naranpura, Ahmedabad-380013. Tel.No.079-29601200/01/02
 E-mail: investor@ratnamani.com, Website: www.ratnamani.com
 CIN: L70109GJ1983PLC006460](https://baan.net.in/Also, prospective bidders may contact for the Odhav Branch Mr. Aazad N Prasad 9978446540/GST/TDS as per Government Rules applicable shall be payable by purchaser on sale of Movable/Immovable Assets.</p>
<p>AS PER SARFAESI ACT, STATUTORY -15 DAYS SALE NOTICE TO THE BORROWER /GUARANTOR/ MORTGAGOR</p>
<p>The above mentioned borrower is/ are hereby notified to pay the sum as mentioned in section 13(2) Notice in full before the date of auction, failing which property will be auctioned / sold and balance dues if any will be recovered with interest and cost from borrower/ guarantors/mortgagor.</p>
<p>Date : 14.02.2025 Place - Ahmedabad

 Authorized Officer, BANK OF BARODA</p>
</div>
<div data-bbox=)

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Nine Months Ended December 31, 2024

(₹ in Lakhs except as stated)

Sr. No.	Particulars	Quarter Ended			Nine Months Ended		Year Ended
		31.12.2024 (Unaudited)	30.09.2024 (Unaudited)	31.12.2023 (Unaudited)	31.12.2024 (Unaudited)	31.12.2023 (Unaudited)	
1	Total Income	1,33,499.50	99,086.46	1,27,246.78	3,52,183.53	3,59,779.62	5,13,231.03
2	Net Profit for the period (before tax, exceptional and extraordinary items)	18,811.69	13,358.45	17,812.79	46,205.17	57,987.77	82,767.04
3	Net Profit for the period before tax (after exceptional and extraordinary items)	18,811.69	13,358.45	17,812.79	46,205.17	57,987.77	82,767.04
4	Net Profit for the period after tax (after exceptional and extraordinary items)	13,317.57	9,935.35	13,279.16	33,841.07	43,198.49	62,510.05
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	13,311.40	9,925.05	13,330.47	33,815.39	43,361.70	62,301.35
6	Equity Share Capital	1,401.84	1,401.84	1,401.84	1,401.84	1,401.84	1,401.84
7	Other Equity excluding Revaluation Reserves as at 31st March	-	-	-	-	-	- 3,12,650.95
8	Earnings per Share (Face Value of ₹ 2 each) (not annualised for quarters): Basic - (₹) Diluted - (₹)	19.00 18.99	14.17 14.17	18.94 18.94	48.28 48.27	61.63 61.63	89.18 89.18

- Notes:**
- The above is an extract of the detailed format of Quarterly and nine months ended on December 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Consolidated Financial Results for the quarter and nine months ended on December 31, 2024 are available on the websites of the Stock Exchange(s) www.nseindia.com and www.bseindia.com and on the Company's Website www.ratnamani.com.
 - The above consolidated financial results of Ratnamani Metals & Tubes Limited ("the Holding Company") along with its subsidiaries (the Holding Company and its subsidiaries together referred to as "the Group") were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on February 12, 2025. The financial results include results of the following subsidiaries:
 1. Ratnamani INC
 2. Ravi Technoforge Private Limited
 3. Ratnamani Finow Spooling Solutions Private Limited
 4. Ratnamani Trade EU AG
 5. Ratnamani Middle East Pipes Trading - L.L.C. - O.P.C
 - The Nomination and Remuneration Committee (Compensation Committee) of the Board of Directors of the Company at its meeting held on November 14, 2024 has approved grant of 4,23,994 stock options to the eligible employee(s) of Ratnamani Metals & Tubes Limited (Company) and 7,230 stock options to the eligible employee(s) of Ratnamani Finow Spooling Solutions Private Limited, (subsidiary of the Company). This Scheme has been approved by the Board of Directors vide its resolution dated May 16, 2024 and also by the Shareholders on August 27, 2024 in terms of the Companies Act, 2013 and the SEBI (Share Based Employee Benefits and Sweat Equity) Regulations, 2021.
 The eligible employees will be entitled to receive equity shares of the Company at the exercise price of ₹ 2,635/- per share upon exercise of options subject to terms and conditions specified in the scheme.
 - The Company has subscribed to 60% of the Equity Shares of "Ratnamani Trade EU AG" amounting to ₹ 535.06 Lacs on December 18, 2024. Consequently, the results for the quarter ended on September 30, 2024, quarter and nine months ended on December 31, 2023 and year ended on March 31, 2024 does not include the results of "Ratnamani Trade EU AG" and are not comparable to the quarter and nine months ended on December 31, 2024.
 - The Company has subscribed to 100% of the Equity Shares of "Ratnamani Middle East Pipe Trading" amounting to ₹ 11.44 Lacs on October 01, 2024. Consequently, the results for the quarter ended on September 30, 2024, quarter and nine months ended on December 31, 2023 and year ended on March 31, 2024 does not include the results of "Ratnamani Middle East Pipe Trading" and are not comparable to the quarter and nine months ended on December 31, 2024.
 - During the quarter ended September 30, 2024, the Holding Company acquired Shares from the selling shareholders of Ravi Technoforge Private Limited ("RTL" - a subsidiary of the Company), as per the terms of the agreement. Consequently, the non-controlling interest derecognised and transferred to owner's equity.
 - Key numbers of Standalone Financial Results of the Company for the Quarter and Nine Months ended December 31, 2024 are as under: (₹ in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended			Nine Months Ended		Year Ended
		31.12.2024 (Unaudited)	30.09.2024 (Unaudited)	31.12.2023 (Unaudited)	31.12.2024 (Unaudited)	31.12.2023 (Unaudited)	
a	Total Income	1,30,716.79	91,700.49	1,21,182.07	3,34,671.67	3,41,633.76	4,85,326.00
b	Net Profit for the period (before tax, exceptional and extraordinary items)	20,042.96	13,693.93	17,907.66	47,667.47	58,741.62	80,975.12
c	Net Profit for the period after tax (after exceptional and extraordinary items)	14,555.05	10,246.30	13,447.47	35,326.85	44,044.52	60,860.56
d	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	14,545.82	10,237.07	13,498.68	35,300.86	44,205.80	60,656.89

The Standalone Financial Results are available at the Company's website www.ratnamani.com and on the website of the stock exchanges www.bseindia.com and www.nseindia.com.

8. Consolidated segment wise Revenue, Results, Assets & Liabilities for the Quarter and Nine Months ended 31st December, 2024

Particulars	Quarter Ended			Nine Months Ended		Year Ended
	31.12.2024 (Unaudited)	30.09.2024 (Unaudited)	31.12.2023 (Unaudited)	31.12.2024 (Unaudited)	31.12.2023 (Unaudited)	
Segment Revenue						
a. Steel Tubes and Pipes	1,25,193.16	89,714.68	1,19,860.64	3,25,926.45	3,38,182.00	4,80,398.64
b. Bearing Rings	6,362.27	6,818.30	5,865.05	20,189.71	18,157.09	25,496.62
c. Pipe Spools and Auxiliary Support Systems	74.83	599.93	-	1,016.68	-	14.17
Total Revenue from Operations	1,31,630.26	97,132.91	1,25,725.69	3,47,132.84	3,56,339.09	5,05,909.63
Segment Results						
a. Steel Tubes and Pipes	17,900.08	13,616.16	17,992.30	45,659.08	58,351.00	80,763.24
b. Bearing Rings	447.48	318.61	451.11	1,224.54	1,242.18	1,859.04
c. Pipe Spools and Auxiliary Support Systems	400.57	(296.60)	-	125.48	-	(210.77)
Total	18,748.13	13,838.17	18,443.41	47,009.10	59,593.18	82,411.51
Add: Interest & Dividend Income & Fair value gain on financial instruments at fair value through profit and loss	810.57	877.47	640.48	2,272.00	1,734.39	4,868.06
Less:- Interest & Finance charges	747.01	1,357.19	1,271.10	3,075.93	3,339.80	4,512.53
Profit before tax	18,811.69	13,358.45	17,812.79	46,205.17	57,987.77	82,767.04
Segment Assets						
a. Steel Tubes and Pipes	4,21,010.44	4,02,643.58	4,03,591.38	4,21,010.44	4,03,591.38	3,76,462.13
b. Bearing Rings	21,494.33	20,415.98	23,936.38	21,494.33	23,936.38	24,300.93

